

ત્વરિત જાહેરાત માટે

2020 બ્રેમ્પટન સીટીઝન્સ એવોર્ડ્સ માટે ઉત્કૃષ્ટ રહેવાસી નોમિનેટ કરો (નામાંકન કરાવો)!

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 6, 2021) – સીટી ઓફ બ્રેમ્પટન હવે વર્ષ 2020 નાં બ્રેમ્પટન સીટીઝન્સ એવોર્ડ્સ માટે અરજીઓ સ્વીકારી રહ્યું છે. તા. ફેબ્રુઆરી 16, 2021 પહેલાં ઉત્કૃષ્ટ રમતવીરો, સ્વયંસેવકો અને સ્થાનિક વીરપુરુષોનું નામાંકન કરાવો.

બ્રેમ્પટન સીટીઝન્સ એવોર્ડ્સ 2020 કેલેન્ડર વર્ષ દરમિયાન નીચે જણાવેલ પૈકી એક શ્રેણીમાં અર્થસભર ફાળો આપનાર અથવા નોંધપાત્ર ઉપલબ્ધિ મેળવનાર રહેવાસીઓને ઓળખ આપે છે:

- **સ્પોર્ટ્સ એચિવમેન્ટ એવોર્ડ** (રમતગમતમાં ઉપલબ્ધિ પુરસ્કાર) એ બ્રેમ્પટન રહેવાસીઓને ઓળખ આપે છે જેઓની ઉપલબ્ધિઓને પ્રાંતીય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હોય.
- **કેન ગિલ્સ (Ken Giles) એમેચ્યોર એથલીટ ઓફ ધી ઈયર એવોર્ડ** પોતાની સંબંધિત રમતમાં કલાપ્રેમી સ્તરે નોંધપાત્ર પ્રભાવ પાડનાર અને/અથવા અપવાદમય ઉપલબ્ધિ મેળવનાર ઉત્કૃષ્ટ વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે છે.
- **આર્ટ્સ અકલેઈમ એવોર્ડ** (કળા પ્રશંસા પુરસ્કાર) એ વ્યક્તિઓને ઓળખ આપે છે જેઓના ક્ષણિક સ્થાનિક, પ્રાંતીય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પ્રશંસા હાસલ કરવાના સંદર્ભમાં નોંધપાત્ર પ્રભાવ પડ્યો હોય.
- **લોંગ ટર્મ સર્વિસ એવોર્ડ** (લાંબા ગાળાની સેવા પુરસ્કાર) એ કટિબદ્ધ સ્વયંસેવકોને ઓળખ આપે છે જેઓના પ્રયત્નોથી મનોરંજનલક્ષી રમતો, કળા અને સામુદાયિક સામાજિક સેવાઓ વિકસાવવા અને તેમાં આગળ વધવા તરફ નોંધપાત્ર પ્રભાવ પડ્યો હોય.
- **ઈન્સ્પિરેશનલ એવોર્ડ** (પ્રેરણાલક્ષી પુરસ્કાર) બ્રેમ્પટનના એ રહેવાસીઓને ઓળખ આપે છે જેઓ માયાળુ કામગીરી માટેની વકાલત અથવા મહાવરો કરતા હોય, અથવા જેઓએ અન્ય લોકો પર પ્રેરણાત્મક પ્રભાવ પાડ્યો હોય.
- **ઈમરજન્સી સર્વિસીસ એવોર્ડ ઓફ વેલોર** (કટોકટી સેવાઓ માટે વીરતા પુરસ્કાર) એ લોકો, જેઓએ અન્ય ચોક્કસ વ્યક્તિનું જીવન બચાવવા પરાક્રમી કાર્ય કરીને પોતાનું જીવન સ્વૈચ્છિકપણે જોખમમાં મૂક્યું હોય.
- **સીટીઝન્સ ઓફ ધી ઈયર એવોર્ડ્સ** (વર્ષના પ્રભાવશાળી નાગરિક પુરસ્કાર) ગત વર્ષ 2020 માં જુસ્સાભર, સમર્પિત સામુદાયિક સંડોવણી દર્શાવનાર બધી ઉંમરના બ્રેમ્પટન સ્વયંસેવકોને ઓળખ આપે છે.

ચૂંટાયેલા અધિકારીઓ, બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ, ધી બ્રેમ્પટન સ્પોર્ટ્સ એલાયન્સ, ધી બ્રેમ્પટન સીનિયર્સ કાઉન્સિલ અને પીલ રીજીયનલ પોલીસની સાથે સાથે, એવોર્ડ શ્રેણીઓમાં વિષયવાર નિપુણતા ધરાવતા સામુદાયિક સભ્યોથી બનેલી પસંદગી સમિતિ (સિલેક્શન કમિટી) બધાં નામાંકનોની સમીક્ષા કરવા માટે નિમવામાં આવી છે.

2019 બ્રેમ્પટન સીટીઝન્સ એવોર્ડ્સ

COVID-19 ને લીધે, સીટી ઓફ બ્રેમ્પટન વર્ષ 2019 નાં બ્રેમ્પટન સીટીઝન્સ એવોર્ડ્સ મેળવનારાઓની કટર કરવા રૂબરૂ પ્રસંગનું આયોજન કરી શક્યું ન હતું. 2019 માં એવોર્ડ મેળવનાર લોકોને આ વર્ષે 2020 માં એવોર્ડ મેળવનારાઓ સાથેના જોડાણમાં ઓળખ આપવામાં આવશે.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન સીટીઝન્સ એવોર્ડ્સ ઉત્કૃષ્ટ બ્રેમ્પનવાસીઓને ઓળખ આપવાની એક મહત્વની તક છે. આ એવોર્ડ્સ આપણાં સમુદાયમાં ફાળો આપવા દરેક વ્યક્તિને ગૌરવ, પ્રોત્સાહન પૂરું પાડે છે, અને આપણાં નાગરિકોના અર્થસભર ફાળા માટે તેઓની કદર કરે છે. કોઈ રહેવાસીનું નામાંકન આજે જ દાખલ કરો!”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટનના સીટીઝન્સ એવોર્ડ્સ વર્ષ 1974 થી આપણાં સમુદાયમાં એક પરંપરા બની છે. અમે 2020 માં આપણાં શહેરમાં નોંધપાત્ર પ્રભાવ પાડનાર બ્રેમ્પટનના રમતવીરો, સ્વયંસેવકો અને વીરોને શોધીને, તેઓ બધાં સમય માટે આપણાં સમુદાય વચ્ચે ઓળખ અપાવવા તત્પર છીએ.”

- માર્ટિન મેડેઇરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; પ્રમુખ, સીટીઝન એવોર્ડ્સ કમિટી, સીટી ઓફ બ્રેમ્પટન

“નામાંકનો હવે 2020 બ્રેમ્પટન સીટીઝન્સ એવોર્ડ માટે ખુલ્લા છે! દર વર્ષે, અમે આ એવોર્ડ્સ માટે આશ્ચર્યજનક પ્રસ્તુતિઓની સંભાવનાઓ જોઈએ છીએ. બ્રેમ્પટનવાસીઓ આપણાં મહાન શહેરમાં દરરોજ ખરેખરો તફાવત લાવી રહ્યાં છે, અને પસંદગી સમિતિ આ વર્ષના નોમિનીઓ (નિર્દિષ્ટ નામો) અને એવોર્ડ મેળવનારાઓ પસંદ કરવા આતુર છે.”

- હરકિરત સિંહ (Harkirat Singh), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10; પ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન તફાવત ઊભો કરનારાઓથી ભરપૂર છે, અને બ્રેમ્પટન સીટીઝન્સ એવોર્ડ્સ આપણાં સમુદાયમાં તેઓના ઉત્કૃષ્ટ ફાળાને ઓળખ આપે છે. રમતવીરોથી માંડીને સ્વયંસેવકોથી માંડીને સ્થાનિક વીરો સુધી, તમે વખાણતા હો તેવા 2020 માં ચડિયાતો પ્રભાવ પાડનાર ચોક્કસ વ્યક્તિનું નામાંકન દાખલ કરો.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca